

May 17th, 2023

<p>To, The Manager-Listing Department, The National Stock Exchange of India Limited, Exchange Plaza, Plot No. C/1, G-Block, Bandra Kurla complex, Bandra East, Mumbai-400 051 Trading Symbol: DEVIT</p>	<p>To, The Secretary, BSE Limited Phiroze Jeebhoy Towers, Dalal Street Mumbai -400001 Trading Symbol: 543462</p>
--	--

Sub: Newspaper advertisement for Financial Results

Ref.: Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

With reference to the captioned subject and pursuant to Regulation 47 & 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we, Dev Information Technology Limited (the "Company") are submitting herewith enclosed copy of newspaper cutting regarding the information published for members in regards with Financial results for the quarter and year ended on March, 2023 in today' Business Standard English edition, Ahmadabad and 'Jai Hind', Gujarati edition (Vernacular Language), Ahmadabad, dated May 17, 2023.

This is for your information and record.

Thanking you,

Yours faithfully,

For **Dev Information Technology Limited**

Krisa Patel
(Company Secretary & Compliance Officer)

Place: Ahmedabad

Encl: a/a

CENTRUM Home Loans
Corporate & Registered Office - Unit No. 801, Centrum House, CST Road, Vidyanagri Marg, Kalina, Santacruz (East), Mumbai - 400098. CIN No. U65922MH2016PLC273826

Public Notice - Closure of Centrum Housing Finance Limited - Branch Office - Jamnagar

General public and customers are hereby informed that the **Jamnagar Branch of Centrum Housing Finance Limited** which is presently functioning at **Office No. 315, 3rd Floor, Madhav Plaza, Opposite SBI Bank, Lal Bungalow, Jamnagar - 361001, Gujarat** will be permanently closed effective from June 3, 2023. Thereafter, all the existing customers of the Jamnagar Branch shall continue to be served from Rajkot Branch situated at **Office No. 406, The Imperial Heights, Wing - C, 150 Ft Ring Road, Opposite Big Bazaar, Rajkot - 360005, Gujarat.**

Place: Jamnagar, Date: 17.05.2023

Authorized Officer, Centrum Housing Finance Limited

Indian Bank
Salabatpura (Nanpura Branch), Salabatpura, Shop No. 4, Trade House, Ground Floor, Ring Road, Surat.

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas, the undersigned being the authorized officer of Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred to him under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 10/03/2023 calling upon the borrower/guarantor **Mr. Rajesh Savjibhai Desai (Borrower and Mortgagor) & Mr. Sanjaybhai Savjibhai Desai (Co-Borrower)** to repay the amount mentioned in the notice being **Rs.52,08,808/-** (Rupees Fifty Two Lakh Eight Thousand Eight Hundred Eight only) within 60 days from the date of receipt of the said notice.

The Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrowers and the guarantors and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of the powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules on 12th day of MAY 2023.

The borrowers/guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Indian Bank, Salabatpura Branch, Surat for an amount **Rs.52,08,808/-** (Rupees Fifty Two Lakh Eight Thousand Eight Hundred Eight only) as on 10/03/2023 and future interest & expenses thereon.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of the time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All right, title and interest in Plot No. 88 as per KJP Block No. 518/b/Paiki 88, admeasuring 6.40 X 13.72 i.e. 87.81 sq. mtrs., together with undivided Proportionate share adm. 51.94 sq. mtrs. in road & COP in "Shantivan Society" situated on the land bearing R.S.No. 565, Block No. 518/B of Village - Kamrej Taluka - Kamrej, Dist. Surat. The Boundaries of the Property are: North: Plot no. 89, South: Plot no. 87, East: Society's Road, West: Plot no. 79.

Date: 12/05/2023
Place: Surat

Authorized Officer, Indian Bank, Salabatpura, Surat.

Indian Bank
Salabatpura (Nanpura Branch), Salabatpura, Shop No. 4, Trade House, Ground Floor, Ring Road, Surat.

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas, the undersigned being the authorized officer of Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred to him under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 13/02/2023 calling upon the borrower/guarantor **Mrs. Shefali Ketan Shah (Borrower and Mortgagor) & Mr. Himensh Babubhai Bambawala (Guarantor)** to repay the amount mentioned in the notice being **Rs.7,96,702/-** (Rupees Seven Lakh Ninety Six Thousand Seven hundred Two only) within 60 days from the date of receipt of the said notice.

The Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrowers and the guarantors and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of the powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules on 12th day of MAY 2023.

The borrowers/guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Indian Bank, Salabatpura Branch, Surat for an amount **Rs.7,96,702/-** (Rupees Seven Lakh Ninety Six Thousand Seven hundred Two only) as on 13/02/2023 and future interest & expenses thereon.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of the time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All right, title and interest in Flat No. 202 on 2nd floor, adm. 501 sq.fts. i.e. 46.54 sq. mtrs. Super Built up area together with undivided Proportionate share in underneath land in "Shradha Residency" situated and constructed on the land bearing W.No.02 Nondh No. 2069 total admeasuring 68.56 sq. mtrs. After S.M.C. road alignment adm. 57.76 sq. mtrs., situated at of Kumbharwad, Taluka: Surat City District - Surat. The Boundaries of the Property are: North: Adjoining Structure, South: Adjoining Structure, East: Main Entrance/Passage, West: Municipal Lane.

Date: 12/05/2023
Place: Surat

Authorized Officer, Indian Bank, Salabatpura, Surat.

EIMCO ELECON (INDIA) LTD.
CIN : L29199GJ1974PLC002574

Regd. Office: Anand-Sojitra Road, Vallabh Vidyanagar-388120, Gujarat
Ph : (02692) 230602 Fax : (02692) 236506.
Email : investor@eimcoelecon.in Website : www.eimcoelecon.in

NOTICE

(For the attention of Equity Shareholders of the Company)
Transfer of unclaimed equity shares of the Company to the Investor Education and Protection Fund (IEPF).

NOTICE is hereby given pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 ("The Act") read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("The Rules") notified by the Ministry of Corporate Affairs (MCA), Government of India, and subsequent amendment thereto, the dividend declared during the financial year 2015-16, which remained unclaimed for a period of seven years will be credited to the IEPF. The Corresponding shares on which dividend was unclaimed for seven consecutive years will also be transferred as per the procedures set out in the rules.

The Company will not transfer such shares to the IEPF where there specific order of Court/Tribunal restraining any transfer of such shares or where the shares are hypothecated/pledged under the Depositories Act, 1996.

The Company has communicated individually to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF under the said Rules for taking appropriate action(s). Share holders concerned may refer to the web site www.eimcoelecon.in to verify the details of their shares liable to be transferred to IEPF authority.

Shareholders are requested to claim the dividends, if any, remaining unpaid/unclaimed from the financial year 2015-16 and onwards before the same is transferred to the IEPF by making application to Link Intime India Private Limited, Registrar and Share Transfer Agent (RTA) of the Company.

The concerned shareholders holding shares in Physical form and whose shares are liable to be transferred to IEPF, may please note that the Company would be issuing duplicate share certificate(s) in lieu of original shares certificate(s) held by them for the purpose of conversion into DEMAT form and subsequent transfer in DEMAT Account of IEPF Authority. The original share certificate(s) which are registered in the name of the original shareholders will stand automatically cancelled and be deemed non-negotiable. Further, the concerned shareholders who are holding share in DEMAT form, may please note that the transfer of share in DEMAT account of the IEPF Authority will be effected by the Company through the respective Depository by way of Corporate Action.

In case the Company does not receive any communications from the concerned shareholder on or before 31st August, 2023 the Company shall credit those shares with the IEPF Authority. Any further Dividend on such shares shall be credited to the IEPF. The concerned shareholder may further note that upon credit of such shares to the said DEMAT Account, no claim shall lie against the Company in respect of the unclaimed dividend amount and the shares transferred to IEPF Demat Account. However, shareholder(s) may claim back the shares credited along with the unclaimed dividend amount from IEPF Authority after following the procedure prescribed by the IEPF Rules. The procedure for claiming the same is available at www.iepf.gov.in.

In case the shareholder(s) have any queries on the subject matter, they may contact to the Company at the contact details given above or contact Company's RTA at the following address:
Link Intime India Private Limited, Unit : Eimco Elecon (India) Limited, B Tower, 102 B & 103, Shangrila Complex, First Floor, Opp. HDFC Bank, Near Radhakrishna Char Rasta, Akota, Vadodara-390020, Tel: +91 - 265 2356573 / 6136000, Fax: +91 - 265 2356791, Email: vadodara@linkintime.co.in, Website: www.linkintime.co.in.

For Eimco Elecon (India) Limited
Sd/-
Place : Vallabh Vidyanagar
Date : 16th May, 2023
Rikenkumar Dalwadi - Company Secretary

SBI STATE BANK OF INDIA
Stressed Assets Recovery Branch (10059) 7th Floor, Paradise Complex, Near Kala Ghoda Circle Sayajinagar, Vadodara-390020

Annexure - 12 Publication of Notice regarding possession of property u/s 13(4) of SARA/ESI Act 2002

Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, a demand notice was issued on the dates mentioned against each account and stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of power conferred on him/her under section 13(4) of the said Act read with Rule 9 of the said Act on the dates mentioned against each account. The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **STATE BANK OF INDIA** for an amount and interest thereon.

Name of Account / Borrower & address	Name of Proprietor/ Partners/Guarantors/ Owner of property etc.	Description of the property mortgaged / charged	Date of Demand Notice	Date & Type of Possession & Order No.	Amount Outstanding
Smt Rashmiben Pankajbhai Patel	Smt Rashmiben Pankajbhai Patel	All that is part and parcel of the property consisting of Registration District Vadodara, Sub District Vadodara, Mouje Tandajla, R.S. No: 391 Paiki, T.P. No: 22, F.P. No: 32, C.S. No: 575, At Flat No. 101, First Floor, Tower A, Aries Pride (Saraswati Society), Tandajla, Vadodara. Super Built Up Area: 2000.00 Sq. Ft. The boundaries are as under - West: Other property, East : Flat no. A/102, Aries Pride, North: Joggers Park Society, South: 9.00 mtr road	30.05.2022	Physical & 14.05.2023 & Order dated 10.04.2023 by Hon'ble Chief Judicial Magistrate, Vadodara in CRMA J No. 3984 of 2022	Rs. 75,18,430.00 (Rupees Seventy Five Lakh Eighteen Thousand Four Hundred Thirty Only) as on 29.05.2022 together with further interest at the contractual rate on aforesaid amount together with incidental expenses, costs and charges thereon.

Date : 17.05.2023
Place : Vadodara

Authorized Officer
State Bank of India, SARB, Vadodara

TMB Tamilnad Mercantile Bank Limited
Himatnagar Branch
C.S.2876, Vasant Bhuvan, Near Amarsinhji Shopping Mall, Tower Road, Himatnagar -383 001, Cell : 9909020780, 02772 - 245780
Email: Himatnagar@tmbank.in

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

Auction Sale Notice for Sale of Immovable Assets mortgaged / charged to the Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) and 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s): **M/s Piplawala Agencies, Proprietor/Mortgagor: Mr. Mohammed Arif Haji Abdulkadar Piplawala S/o Mr. Abdulkadar, mortgagor(s)/Guarantor(s): Mr. Mohammed Ayyub Haji Abdul Kadar Piplawala S/o Mr. Abdulkadar**, the below described immovable property mortgaged to the Secured Creditor, the constructive possession of which has been taken by the Authorised Officer of Tamilnad Mercantile Bank Limited., Himatnagar Branch, (Secured Creditor), will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 08.06.2023 for the recovery of a sum of **1,40,43,920.24 (Rupees One Crore Forty Lakhs Forty Three Thousand Nine Hundred Twenty and Paise Twenty Four Only)** (Cash Credit for Rs. 1,14,82,872.00 and Term Loan -GECL-1 for Rs. 14,53,993.24 and Term Loan -GECL-2 for Rs. 11,07,055 as on 30.04.2023) due to Tamilnad Mercantile Bank Limited., Himatnagar Branch plus interest and expenses.

Property No:1 The reserve price will be **Rs. 28,70,000/-** and the earnest money deposit will be **Rs. 2,87,000/-**
Property No:2 The reserve price will be **Rs. 32,21,000/-** and the earnest money deposit will be **Rs. 3,22,100/-**
Property No:2 The reserve price will be **Rs. 17,10,000/-** and the earnest money deposit will be **Rs. 1,71,000/-**

Description of Property

- All those pieces and parcels of immovable Property bearing shop nos. 21,22,23 situated at Lower level of New City Survey No.1682 construction admeasuring about 33-77 sq.mtr (Inner Carpet area) bearing Himatnagar Nagarpalika property nos. 7/88/20, 7/88/21 and 7/88/22 known as Jivandhara complex within the limits of Himatnagar Nagarpalika and in the city survey area of Himatnagar Dist Sabarkantha. Standing in the name of Mr.Mohammed Arif Haji Abdulkadar Piplawala. **Boundaries:** North: Leaving passage shop no.8 of Low-level, South: Shop No.24 of Lower level, East: Shop no.17, 18, 19 of Lower level, West: Passage of shopping Complex
- Property bearing Gharthari Plot No.197-A of City Survey no.438 Paikae land admeasuring about 92-90 Sq.Mtr.bearing Himatnagar Nagarpalika Property no.4/1612/1 situated on the northern side of Pratap palace, Himatnagar, within the limit of Himatnagar Nagarpalika and in the city survey area of Himatnagar Dist., S.K. Standing in the name of Mr.Mohammed Ayyub Haji Abdul Kadar Piplawala. **Boundaries:** North : Gharthari plot no.179-B, wherein constricted Ramdev Memon, South : Gharthari plot no.197-B, wherein constricted Jamnadmahbi/memon, East : Gharthari plot no.196-A, West: 20.00 ft road.
- Property bearing N.A. Plot No.55 of survey no.123/1 total land admeasuring about 157-25 sq.mtrs situated at village Panpur (Savgadh) Ta.Himatnagar within the limits of Savgadh Gram panchayat, Ta.Himatnagar standing in the name of Mr.Mohammed Arif Haji Abdulkadar Piplawala. **Boundaries:** North: Plot No.56, South: Plot No.54, East: Survey No.124, West: 7.62 Mt.Road

For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditors website (www.tmb.in)

Authorized Officer
Tamilnad Mercantile Bank Ltd
Ahmedabad Region
(For Himatnagar Branch)

Place: Himatnagar
Date : 16.05.2023

INVENT ASSETS SECURITISATION & RECONSTRUCTION PRIVATE LIMITED invent

Registered Office: Bakhtwar, Suite 'B', Ground Floor, Backbay Reclamation Scheme Block III, 229, Nariman Point, Mumbai - 400 021. Tel. No 022-22801516. Website: www.inventarc.com

APPENDIX-IV-A [See proviso to rule 8r/w rule 9]

Sale notice for Sale of Immovable properties

PUBLIC NOTICE - AUCTION CUM SALE OF IMMOVABLE PROPERTIES ("SECURED ASSETS") OF MR. HARDIK ZINZUVADIYA ("BORROWER") AND MR. VINAYAK NIMAVAT ("BORROWER") FOR THEIR DUES UNDER RULE 8/R/W RULE 9 OF THE SECURITY INTEREST ENFORCEMENT RULES, 2002.

Whereas, the Authorised Officer of INVENT ASSETS SECURITISATION & RECONSTRUCTION PVT. LTD has taken physical possession of the following properties pursuant to the notice issued under section 13(2) of the "Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARA/ESI Act), in the following loan accounts with right to sell the same on "as is where is basis", "as is what is basis" and "no recourse basis" for realisation of Bank Dues plus interest as detailed hereunder and whereas consequent upon failure to repay the dues, the undersigned in exercise of power conferred under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules proposes to realise the Bank's dues by sale of the said properties. The General Public is invited to bid either personally or through their duly authorised agent. The details of the auction cum sale are as follows:-

Sr No.	Name of the Borrower & Mortgagor	Details of Property	Amount as per Demand Notice	Reserve Price EMD Bid Increase Amount	Last Date and Time Submission of Bids	Date/Time of Auction
1	Hardik Zinzuvadiya	Residential Property at Jamina Complex, Flat No. 106, First Floor, Mukesh Park - 2, street No. 5, National Highway, Rajkot 360002	Rs. 15,57,815/- as on 26th June 2019 along with future interest as per contractual rate and other incidental expenses and costs thereon.	Rs. 5,20,000/- Rs. 52,000/- Rs. 10,000/-	14/06/2023 11:00 AM	14/06/2023 12:00 PM
2	Vinayak Nimavat	Residential Property at Flat no.403, 4th Floor, Ruturaj Building, opp. Swaminarayan Gurukul, Near RMC ward Office, Dhebar Road, Rajkot, 360002.	Rs. 13,80,510/- as on 24th June 2019 along with future interest as per contractual rate and other incidental expenses and costs thereon.	Rs. 10,20,000/- Rs. 1,02,000/- Rs. 10,000/-	14/06/2023 11:00 AM	14/06/2023 12:00 PM

TERMS & CONDITIONS

- The property shall be sold on "as is where is basis", "as is what is basis" and "no recourse basis".
- The property shall be sold at the price higher than or equal to the Reserve Price only and sale is subject to the confirmation by Invent Assets Securitisation & Reconstruction Pvt. Ltd. as secured creditor. In case, the borrower/guarantor / mortgagors pay the dues to INVENT in full before the auction date, then no auction sale will be conducted.
- The intending purchaser may take inspection of the said properties on **26.05.2023** with prior appointment of the authorised officer of Invent between **12.00 p.m. to 5.00 p.m.**
- The intending bidders shall submit bids at Bakhtwar, Suite 'B', Ground Floor, Backbay Reclamation Scheme Block III, 229, Nariman Point, Mumbai - 400 021 in the prescribed format in sealed cover along with Earnest Money Deposit (EMD) to the Authorized officer on or before the last date.
- For any queries, please contact Mr. Ankit Shetty Authorised Officer, Invent Assets Securitisation and Reconstruction Pvt. Ltd. (+91 9920587626), Email id: ankit.shetty@inventarc.com.
- Earnest Money Deposit (EMD) shall be deposited through RTGS/NEFT fund transfer to credit Account No. 000405133379. Name of the Bank: ICICI Bank Ltd., Name of the Beneficiary: Invent Assets Securitisation and Reconstruction Pvt. Ltd., IFSC Code ICIC0000004. Alternatively, Bidders may send a crossed Demand Draft/Pay order in favour of "Invent Assets Securitisation and Reconstruction Pvt. Ltd.", payable at Mumbai. Bidders shall have to attach / enclose a proof of RTGS/NEFT fund transfer or crossed Demand Draft/Pay order along with the bid.
- The Authorised Officer reserves the right to conduct Inter-se bidding / further negotiations amongst the bidders. The highest bidder amongst them after Inter-se bidding / negotiations shall be declared as successful bidder. The Bidders may improve their further offers in multiple of **Rs. 10,000/- (Rupees Ten Thousand only)**.
- The bid once submitted cannot be withdrawn and the bidder has to purchase the property for the quoted price in case the same is the highest bid, failing which EMD shall be forfeited.
- Sale shall be confirmed in favour of the successful bidder; however, confirmation of the sale shall be at the sole discretion of INVENT (the secured creditor).
- The Successful bidder will have to deposit 25% of the total bid amount / purchase consideration (after adjusting amount of EMD) immediately upon acceptance of bid i.e. on the same day but not later than the next working day and balance 75% of the bid amount / purchase price on or before the fifteenth day of the confirmation of the sale of immovable property or such extended period as may be agreed upon by the purchaser and INVENT the secured creditor, in any case not exceeding three months.
- In compliance of the terms and condition of sale and on confirmation of the sale the Authorised Officer shall issue CERTIFICATE OF SALE within four of the last date.
- In case the successful bidder fails to pay the balance sale price as stated above, all deposits including EMD shall be forfeited without further notice.
- The Bids without receipt of EMD amount and/or less than the Reserve price shall not be accepted / confirmed.
- The EMD of unsuccessful bidder will be returned on the closure of the auction sale proceedings. No interest shall be paid on the EMD refunded.
- The Purchaser shall bear the Stamp Duty and charges, including those of Sale Certificate Registration charges, all statutory dues payable to Government, taxes and rates, outgoing both existing and future relating to the property.
- The undersigned Authorised Officer has the absolute right and discretion to accept or reject any bid or adjourn/postpone/cancel the sale/auction and also modify any terms and conditions of the sale without any prior notice and/or assigning any reasons.

Date: 16th May 2023
Place: Rajkot

Authorized Officer
Invent Assets Securitisation & Reconstruction Pvt. Ltd.

DEV Information Technology Limited
Registered Office: 14, Aaryans Corporate Park, Nr. Shilaj Railway Crossing, Thaljej, Ahmedabad, Gujarat - 380059 || Ph : +91-94298 99852 / 53 || Email : cs@devitpl.com Website : <http://www.devitpl.com> || CIN : L30000G1997PLC033479

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023
(Rs. in Lakhs, except per share data)

Sr. No	Particulars	Standalone			Consolidated	
		Quarter ended on 31/03/2023 (Audited)	Quarter ended on 31/03/2023 (Audited)	Quarter ended on 31/03/2022 (Audited)	Quarter ended on 31/03/2023 (Audited)	Quarter ended on 31/03/2022 (Audited)
1	Total Income from operations	4228.16	12893.77	3208.90	4445.80	13112.27
2	Net Profit for the period (before tax, exceptional and/or extraordinary items)	311.61	1082.23	123.40	444.30	1125.63
3	Net Profit for the period before tax (after exceptional and/or extraordinary items)#	311.61	1082.23	123.40	444.30	1125.63
4	Net Profit for the period after tax (after exceptional and/or extraordinary items)	240.89	872.48	75.58	359.78	902.08
5	Total Comprehensive income for the period (comprising Profit for the period (after tax) and Other Comprehensive income (after tax))	244.08	872.88	74.64	362.95	902.47
6	Paid-up Equity Share Capital (face value of Rs.5/- each)	1105.92	1105.92	1104.10	1105.92	1104.10
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-
8	Earnings Per Share (face value of Rs. 5/- each) (for continuing and discontinued operations)	1.09	3.95	0.34	1.63	4.08
	1) Basic	1.09	3.95	0.34	1.63	4.08
	2) Diluted	1.09	3.93	0.34	1.62	4.06

Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules. Notes:

- The above is an extract of the detailed format of Quarterly and Year ended Audited Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Year ended Audited Financial Results are available on the websites of the NSE at www.nseindia.com and BSE at www.bseindia.com and on the website of the Company at the www.devitpl.com
- The above Audited financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on May 16, 2023.
- The Audit as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the Statutory auditor of the Company.
- The Board of Directors in its meeting held on May 16, 2023 has recommended the final dividend at the rate of 5% i.e. Re. 0.25/- per Equity Share of Face Value of Rs. 5/- each for the financial year 2023-24, subject to the approval of shareholders at the ensuing Annual General Meeting of the Company.

For and on behalf of Board of Directors of
Dev Information Technology Limited
s/d/- **Jaimin J. Shah**
Managing Director - DIN : 00021880

Date : 17/05/2023
Place : Ahmedabad

SBI STATE BANK OF INDIA
Stressed Assets Recovery Branch (10059) 7th Floor, Paradise Complex, Near Kala Ghoda Circle Sayajinagar, Vadodara-390020

Annexure - 12 Publication of Notice regarding possession of property u/s 13(4) of SARA/ESI Act 2002

Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, a demand notice was issued on the dates mentioned against each account and stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of power conferred on him/her under section 13(4) of the said Act read with Rule 9 of the said Act on the dates mentioned against each account. The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **STATE BANK OF INDIA** for an amount and interest thereon.

Name of Account / Borrower & address	Name of Proprietor/ Partners/Guarantors/ Owner of property etc.	Description of the property mortgaged / charged	Date of Demand Notice	Date & Type of Possession & Order No.	Amount Outstanding
Shri Lahu V.K. and Smt. Reshmi P.V.	Owner: Shri Lahu V.K. Guarantor: Shri Vijaykumar K Kaiprath	All that piece and Parcel of property bearing Plot No. 35, admeasuring 70.26 sq. mtrs. with proportionate undivided inchoate share of C.O.P and road admeasuring 23.52 sq. mtrs. Land in "Maa Anandi Township", with all appurtenances pertaining thereto, standing on land bearing R.S. No. 8/3/B, 8/3/A, Block No. 14 and Block No. 15, respectively lying, being and situated at Village Deladva, Sub District Choryasi, District Surat. The boundaries are as under- East : Entry and Society Road, West : Adjoining Plot, North : Plot No. 34, South : Plot No. 36.	11.06.2021	12.05.2023 & Physical & Order No. MAG/SARFA ES/CASE NO.2729/21 dated 22.02.2023 by Hon'ble District Magistrate, Surat.	30,79,463.00 (Rupees Thirty lakhs seventy nine thousand four hundred and sixty three only) as on 11.06.2021 together with further interest at the contractual rate on aforesaid amount together with incidental expenses, costs and charges thereon.
Smt. Sheeja Valayalakkndi Kakkannankottath and Smt. Jinsha Valayalakkndi Kakkannankottath	Owner: Smt. Sheeja Valayalakkndi Kakkannankottath Guarantor: Shri Premchand N Pandey	All that piece and Parcel of property bearing Plot No. 33, admeasuring 50.18 sq. mtrs. with proportionate undivided inchoate share of C.O.P and road admeasuring 23.52 sq. mtrs. Land in "Maa Anandi Township", with all appurtenances pertaining thereto, standing on land bearing R.S. No. 8/3/B, 8/3/A, Block No. 14 and Block No. 15, respectively lying, being and situated at Village Deladva, Sub District Choryasi, District Surat. The boundaries are as under- East : Entry and Society Road, West : Adjoining Plot, North : Society Road, South : Plot No. 34.	11.06.2021	12.05.2023 & Physical & Order No. MAG/SARFA ES/CASE NO.2726/21 dated 13.12.2022 by Hon'ble District Magistrate, Surat.	25,40,624.00 (Rupees Twenty five lakhs forty thousand and twenty four only) as on 11.06.2021 together with further interest at the contractual rate on aforesaid amount together with incidental expenses, costs and charges thereon.
Smt. Divya G.P. and Shri Ranjit R Nair	Owner: Smt. Divya G.P. Guarantor: Shri Nareeshbhai Chhibbabbai Morker	All that piece and Parcel of property bearing Plot No. 48, admeasuring 50.18 sq. mtrs. with proportionate undivided inchoate share of C.O.P and road admeasuring 23.52 sq. mtrs. Land in "Maa Anandi Township", with all appurtenances pertaining thereto, standing on land bearing R.S. No. 8/3/B, 8/3/A, Block No. 14 and Block No. 15, respectively lying, being and situated at Village Deladva, Sub District Choryasi, District Surat. The boundaries are as under- East : Open land, West : Entry and Society Road, North : Plot No. 49 South : Plot No. 47.	11.06.2021	12.05.2023 & Physical & Order No. MAG/SARFA ES/CASE NO.2730/21 dated 13.12.2022 by Hon'ble District Magistrate, Surat.	Rs. 25,66,715.00 (Rupees Twenty five lakhs sixty eight thousand seven hundred and fifteen only) as on 11.06.2021 together with further interest at the contractual rate on aforesaid amount together with incidental expenses, costs and charges thereon.
Shri Naveenkumar Nanu Kunhabu and Shri Kandith Nanu Kunhabu	Owner: Shri Naveenkumar Nanu Kunhabu Guarantor: Shri Arvind Mathur Singh	All that piece and Parcel of property bearing Plot No. 50, admeasuring 50.18 sq. mtrs. with proportionate undivided inchoate share of C.O.P and road admeasuring 23.52 sq. mtrs. Land in "Maa Anandi Township", with all appurtenances pertaining thereto, standing on land bearing R.S. No. 8/3/B, 8/3/A, Block No. 14 and Block No. 15, respectively lying, being and situated at Village Deladva, Sub District Choryasi, District Surat. The boundaries are as under- East : Open land, West : Entry and Society Road, North : Plot No. 51 South : Plot No. 49.	14.06.2021	12.05.2023 & Physical & Order No. MAG/SARFA ES/CASE NO.2732/21 dated 13.12.2022 by Hon'ble District Magistrate, Surat.	Rs. 23,86,524 (Rupees Twenty three lakhs eighty six thousand five hundred and twenty four only) as on 14.06.2021 together with further interest at the contractual rate on aforesaid amount together with incidental expenses, costs and charges thereon.
Smt. Bijila Shaji and Shri Shaji V.K.	Owners: Smt. Bijila Shaji and Shri Shaji V.K. Guarantor: Shri Jaychandra Kunhabu Muthalakadian	All that piece and Parcel of property bearing Plot No. 49, admeasuring 50.80 sq. mtrs. with proportionate undivided inchoate share of C.O.P and road admeasuring 23.52 sq. mtrs. Land in "Maa Anandi Township", with all appurtenances pertaining thereto, standing on land bearing R.S. No. 8/3/B, 8/3/A, Block No. 14 and Block No. 15, respectively lying, being and situated at Village Deladva, Sub District Choryasi, District Surat. The boundaries are as under- East : Open land, West : Entry and Society Road, North : Plot No. 50 South : Plot No. 48.	30.07.2021	12.05.2023 & Physical & Order No. MAG/SARFA ES/CASE NO.309/22 dated 10.02.2023 by Hon'ble District Magistrate, Surat.	23,52,835 (Rupees Twenty three lakhs fifty two thousand four hundred and thirty five only) as on 30.07.2021 together with further interest at the contractual rate on aforesaid amount together with incidental expenses, costs and charges thereon.
Shri Sanal Narayan Pacha and Smt Sheena Soman Pacha	Owner: Shri Sanal Narayan Pacha Guarantor: Shri Brahmdevsingh Tiakdharisingh Rajput	All that piece and Parcel of property bearing Plot No. 47, admeasuring 50.18 sq. mtrs. with proportionate undivided inchoate share of C.O.P and road admeasuring 23.52 sq. mtrs. Land in "Maa Anandi Township", with all appurtenances pertaining thereto, standing on land bearing R.S. No. 8/3/B, 8/3/A, Block No. 14 and Block No. 15, respectively lying, being and situated at Village Deladva, Sub District Choryasi, District Surat. The boundaries are as under- East : Open land, West : Entry and Society Road, North : Plot No. 48 South : Plot No. 46.	11.06.2021	12.05.2023 & Physical & Order No. MAG/SARFA ES/CASE NO.2728/21 dated 22.12.2022 by Hon'ble District Magistrate, Surat.	Rs. 27,95,728.00 (Rupees Twenty seven lakhs ninety five thousand seven hundred and twenty eight only) as on 11.06.2021 together with further interest at the contractual rate on aforesaid amount together with incidental expenses, costs and charges thereon.
Smt. Kajalbh Paresbhhai Kanani & Shri Paresbhhai Mansukhbhai Kanani	Owners: Smt. Kajalbh Paresbhhai Kanani & Shri Paresbhhai Mansukhbhai Kanani	All that piece and parcel of the immovable property bearing RS. 111/2, Block No. 102/A, 102/B, 102/C & 102/D, TPS No. 18 (Mota Varacha) F.P. No. 48, 49, 50 & 51, Building No. B. Flat No.1001 (having super builtup area of 2600 sq feet & builtup area of 1562.03 sq feet), Ambika Pinnacle, 10th floor, Nr. Lajman Chowk, Mota Varacha, Ta. Surat city, Dist. Surat. The boundaries are as under- East : Society Boundary, West : COP, North : Ambika Pinnacle Commercial Building, South : Passage and Flat No. 1002.	24.01.2022	13.05.2023	

બેન્કોના ખાનગીકરણનો બીજો તબક્કો શરૂ: ટાઈમટેબલ નિશ્ચિત થશે

UCO- બેન્ક ઓફ મહારાષ્ટ્રનું ખાનગીકરણ કરવા તૈયારી

નવી દિલ્હી: દેશની રાષ્ટ્રીયકૃત બેન્કોની કુલ સંખ્યા ૫-૬ રાખીને અન્ય સરકારી બેન્કોના ખાનગીકરણનો હવે બીજો તબક્કો શરૂ થયો છે અને આ માટે એક ખાસ કમીટી ભલામણ આપવા જણાવ્યું છે. છેલ્લા બે

કારણો તથા યુકેન યુદ્ધ વિ.ની જે અર્થતંત્ર તથા શેરબજાર પર અસર પડી હતી તેથી સરકારે આ ખાનગીકરણની પ્રક્રિયા સંભાળી દેવામાં આવી હતી પણ હવે સરકાર પુરી રીતે બેન્કોના ખાનગીકરણની પ્રક્રિયાએ આગળ

અગાઉના વ્યુહમાં ફેરફાર: હાલ સેન્ટ્રલ બેન્ક- આઈઓબીને 'હાથ' નહીં અડાડાય: નાની સરકારી બેન્કોના નફા વધ્યા; એનપીએ ઘટતા વધુ સારી શેર-વેલ્યુ મળવાનો અંદાજ

વર્ષમાં સરકારી બેન્કોની બેલોન્સ સહિતની એનપીએની સ્થિતિ સુધરી છે અને ઉંચા પ્રોવિઝનના કારણે બેન્કોને જે નફામાં ઘટાડો થયો હતો તે સ્થિતિનો અંત આવીને હવે રાષ્ટ્રીયકૃત બેન્કો કરી તેના સારા બેલેન્સશીટ સાથે નફો વધારી રહી છે. જેના કારણે બેન્કોના વેલ્યુએશનમાં પણ વધારો થયો છે. જે કે અગાઉ સરકારે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્કના ખાનગીકરણની તૈયારી કરી હતી પણ કોવિડ સહિતના

વધવા માંગે છે અને જે બેન્કો શોર્ટલીસ્ટેડ થશે તેની કેટલી મુદી ક્યારે અને કેટલા તબક્કામાં વેચી તેનો એક સમયબદ્ધ કાર્યક્રમ પણ ઘડી કઢાશે. નાણાવિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ બેન્કોનું ખાનગીકરણ એ હવે સરકારના અગ્રતાના એજન્ડામાં છે પણ હવે કોલેક્સ નાની સરકારી બેન્કો જેમકે બેન્ક ઓફ મહારાષ્ટ્ર યુકો બેન્ક પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક કે પછી બેન્ક ઓફ

બરોડાને આ એજન્ડામાંથી બહાર રખાઈ છે. સરકારે બેન્કોના ખાનગીકરણમાં થોડો પ્રથમ સર્જતી કાનુની જોગવાઈઓ પણ સુધારવા એક ખરડો તૈયાર રાખ્યો છે જે હવે ચોમાસુ સત્રમાં રજૂ કરી શકે છે. જે કે અગાઉ આઈડીબીઆઈના સરકાર હસ્તકના શેરોનું વેચાણ કરી તેને પૂર્ણ રીતે ખાનગીકરણની તૈયારી છે.

૨૦૨૧માં નીતિ આયોગે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્કના ખાનગીકરણની ભલામણ કરી હતી પરંતુ આ બંને બેંકોમાં અન્ય નાની બેંકો ભેળવી દેવાતા હાલ તેનું કદ વધ્યું છે અને તેથી સરકાર તેમાં હાલ આગળ વધવાને બદલે મીડ સાઈઝ અને નાની સરકારી બેન્કો પર નજર કરી રહી છે. જાહેર ક્ષેત્રની બેંકોનો નફો રૂ.૧ લાખ કરોડ

થયો છે અને તેથી પંજાબ અને સિંધ બેંક પણ આ સ્વર્ણમાં છે.

બોગસ-જીએસટી નંબર- તથા બિલીંગ પર ખાસ તપાસ કરાશે

જીએસટી ચોરીમાં ગુજરાત ત્રીજા ક્રમે: દેશભરમાં ખાસ અંબેશ

નવી દિલ્હી: દેશમાં એપ્રિલ માસમાં રેકર્ડબ્રેક જીએસટી કલેક્શન છતા પણ હજુ વ્યાપક રીતે બોગસ બિલીંગ અને અન્ય માર્ગ જીએસટી ચોરી- ગેરરીતિ ચાલતી હોવાના સંકેત બાદ હવે આજથી દેશભરમાં જીએસટીમાં ફરચોટી ઝડપવા ખાસ ડાઈવ દેશભરમાં ચાલુ કરવામાં આવી છે તથા ખાસ કરીને બોગસ જીએસટી નંબર અને તેના આધારે થતા બોગસ બિલીંગ સામે કાર્યવાહી શરુ થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ માટે બે માસની ખાસ અંબેશ શરૂ કરી છે. જે કે

જેમાં પ્રમાણિકતાની જીએસટી ભરે છે અને નિયમીત છે. તેઓ માટે

મની ટ્રેલ: જીએસટી વિભાગ હવે આખરી લાભાર્થીનો પીછો કરશે

નવી દિલ્હી: દેશમાં જીએસટી વિભાગ પણ હવે આવકવેરા વિભાગની જેમ ડેટા-એનાલીસ તથા બેન્કીંગ વ્યવહારના આધારે જીએસટી ચોરી ઝડપશે. જીએસટી વિભાગે આ માટે રજૂ. નંબરની સાથે જોડાયેલા બેન્ક ખાતાઓના વ્યવહારો પર નજર રખાશે અને તેના આધારે બોગસ બિલીંગ અને ખોટી ઈનપુટ ટેક્સ કેટીટના 'હલવા' પણ શોધી કઢાશે. બોગસ બિલીંગમાં જેણે આ બિલ જનરેટ કર્યા હોય તેના જે બેન્ક ખાતામાં અંતે આ રકમ જમા થાય છે. આમ હવે જીએસટી વિભાગ 'મની-ટ્રેલ' પદ્ધતિ અપનાવી રહી છે અને આખરી લાભાર્થી જે મૂળ કરચાર હોઈ શકે છે તેના પરથી તે કરચોરી ઝડપશે. આ માટે ખાસ રાજ્યવાઈઝ ડેટા સેન્ટર પણ કાર્યરત થશે.

કોઈ પરેશાની નથી તે નિશ્ચિત કરાયું છે. બોગસ જીએસટી રજૂ. શોધવા અને તેને રદ કરીને તથા આ ૨૦૨૩ના નાણાકીય વર્ષમાં દેશમાં જીએસટી ચોરીના ૧૪૦૦થી વધુ કેસ: રૂ.૧.૦૧ લાખ કરોડની રકમ શોધાઈ: રૂ.૨૩૦૦૦ કરોડની વસુલાત

પ્રકારના બોગસ જીએસટી નંબરના આધારે જે બોગસ બિલીંગ થયું છે તેનું પગરૂ શોધાશે. ગત મહિને જીએસટીમાં રૂ.૧.૦૧ લાખ કરોડની કરચોરી ઝડપી લેવામાં આવી હતી જે તેના અગાઉના વર્ષ કરતા લગભગ ૭૫% અને તેઓ રૂ.૨૩૦૦૦ કરોડની વસુલાત થઈ શકી છે.

૨૦૨૨ના નાણાકીય વર્ષમાં રૂ.૫૪૦૦૦ કરોડની જીએસટી ચોરી ઝડપાઈ હતી ને રૂ.૨૧૦૦૦ વસુલાત થતા પણ ૨૦૨૩ના નાણાકીય વર્ષમાં કુલ ૧૪૦૦૦ જીએસટી ચોરીના કેસ શોધી કઢાયાની જીએસટી ચોરીમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે જેમાં ૨૦૨૨/૨૩ના વર્ષમાં રૂ.૨૬૧૫૬ કરોડની જીએસટી ચોરી ઝડપી શકાઈ હતી. રૂ.૨૦૦૯ કરોડ વસુલાત થતા

તથા ૧૭૯ લોકોને ઝરપકડ પણ થઈ હતી જ્યારે પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર અને બીજા ક્રમ કર્ણાટક છે. જીએસટી વિભાગે છેલ્લા બે વર્ષના જે ડેટા વિશ્લેષણ કર્યું છે તેના આધારે આ ડાઈવ શરૂ થઈ છે. આ માટે નેશનલ કોઓર્ડિનેશન કમીટી બનાવાઈ છે જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ટરવેરકેટ ટેક્ષના સભ્ય-પ્રિન્સીપાલ ચીફ કમિશ્નર દિલ્હી અને ભોપાલના ચીફ કમિશ્નરનો પણ સમાવેશ થાય છે.

નામ બદલાવેલ છે હું નીચે સહી કરનાર શીતલ વિમલ અંકોલા આથી જાહેર કરું છું કે મેં મારૂ જૂનું નામ દર્શિતાબેન વલ્લભદાસ મારકિયા માંથી બદલાવીને શીતલ વિમલ અંકોલા તરીકે ઓળખાઈશ.

શીતલ વિમલ અંકોલા અમદાવાદ

DEV INFORMATION TECHNOLOGY LIMITED
Registered Office : 14, Aaryans Corporate Park, Nr. Shilaj Railway Crossing, Thaltej, Ahmedabad, Gujarat - 380059 | Ph : +91-94298 99852 / 53 | Email : cs@devitpl.com
Website : https://www.devitpl.com | CIN : L30000GJ1997PLC033479

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023
(Rs. in Lakhs, except per share data)

Sr. No.	Particulars	Standalone			Consolidated	
		Quarter ended on 31/03/2023 (Audited)	Year ended on 31/03/2023 (Audited)	Quarter ended on 31/03/2022 (Audited)	Quarter ended on 31/03/2023 (Audited)	Year ended on 31/03/2022 (Audited)
1	Total Income from operations	4228.16	12893.77	3208.90	4445.80	13112.27
2	Net Profit for the period (before tax, exceptional and/or extraordinary items)	311.61	1082.23	123.40	444.30	1125.63
3	Net Profit for the period before tax (after exceptional and/or extraordinary items)#	311.61	1082.23	123.40	444.30	1125.63
4	Net Profit for the period after tax (after exceptional and/or extraordinary items)	240.89	872.48	75.58	359.78	902.08
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive income (after tax))	244.08	872.88	74.64	362.95	902.47
6	Paid-up Equity Share Capital (face value of Rs.5/- each)	1105.92	1105.92	1104.10	1105.92	1104.10
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-
8	Earnings Per Share (face value of Rs.5/- each) (for continuing and discontinued operations)	1.09	3.95	0.34	1.63	4.08
1)	Basic	1.09	3.95	0.34	1.62	4.06
2)	Diluted	1.09	3.93	0.34	1.62	4.06

Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules. Notes: (1) The above is an extract of the detailed format of Quarterly and Year ended Audited Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Year ended Audited Financial Results are available on the websites of the NSE at www.nseindia.com and BSE at www.bseindia.com and on the website of the Company at the www.devitpl.com (2) The above Audited financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on May 16, 2023. (3) The Audit as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the Statutory auditor of the Company. (4) The Board of Directors in its meeting held on May 16, 2023 has recommended the final dividend at the rate of 5% i.e. Re. 0.25/- per Equity Share of Face Value of Rs. 5/- each for the financial year 2023-24, subject to the approval of shareholders at the ensuing Annual General Meeting of the Company. For and on behalf of Board of Directors of Dev Information Technology Limited sd/- Jaimin J. Shah Managing Director - DIN : 00021880 Date : 17/05/2023 Place : Ahmedabad

એમેઝોન ફરી એક વખત ભારતમાં કર્મચારીઓની કરશે છટણી

નવી દિલ્હી, તા. ૧૬ હાલમાં ભારતમાં નોકરીઓની ભારે અછત છે. આ સિવાય બીજા તરફ અહીંની કંપનીઓ લોકોને નોકરીમાંથી કાઢી રહી છે. દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન ભારતમાં કામ કરતા લોકોને છૂટા કરી રહી છે. જણાવી દઈએ કે કંપની દેશમાં લગભગ ૫૦૦ કર્મચારીઓની છટણીની પ્રક્રિયામાં લાગેલી છે. માર્ચના અંતમાં એમેઝોનના સીઈઓ એની જેસી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી વિશ્વભરમાં આ કંપનીના ૮૦૦૦ કર્મચારીઓને અસર થઈ હતી. કોચી અને લખનૌમાં સેલર ઓનબોર્ડિંગ ફક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે એમેઝોનના સુત્રોએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. એમેઝોન તાજેતરના મહિનાઓમાં બીજા વખત કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ કહ્યું હતું કે લગભગ ૧૮,૦૦૦ કર્મચારીઓની છટણી કરવામાં આવશે. નવેમ્બર ૨૦૨૨ માં, એવું નોંધવામાં આવ્યું હતું કે એમેઝોન તેની વૈશ્વિક યોજના હેઠળ ભારતમાંથી ઘણી નોકરીઓ દૂર

કરશે. એમેઝોન હજુ પણ કંપનીમાં વૃદ્ધિ કરી રહ્યું છે. તેના સૌથી મોટા વિકેતાઓમાંના એક, Appario, ભારતમાં નિયમોનું પાલન કરવા માટે નવા વિકેતાને ઈન્વેન્ટરી ટ્રાન્સફર કરી રહી છે. ગયા વર્ષે, એમેઝોને ભારતમાં તેના કૂડ, ડિલિવરી, એસ્ટેક અને હોલસેલ ડિસ્ટ્રિબ્યુશન સહિત અનેક એમેઝોને ભારતમાં તેના ઘણા બિઝનેસ બંધ કરી દીધા છે

વ્યવસાયો બંધ કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે ગત જાન્યુઆરીમાં કંપનીએ ગુરુગ્રામ, બેંગલુરુ સહિત તેની ઘણી ઓફિસોમાં કર્મચારીઓની છટણી કરી હતી. વિભાગોમાંથી છટણી ખોટ કરતા મોટાભાગથી કરવામાં આવી હતી. આર્થિક મંદીના કારણે મોટાભાગની આઈટી કંપનીઓમાં હલચલ મચી ગઈ છે. વૈશ્વિક મંદીના ઈરને કારણે, અન્ય ઘણી કંપનીઓ પણ તેમના કર્મચારીઓની છટણીમાં વ્યસ્ત છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૨ ના અંતમાં શરૂ થયેલી આર્થિક

pnb વંજાબ નેશનલ બેંક punjab national bank
સર્કલ SASTRA, છક્રુ માળે, ગુજરાત ભવન, એમ.જે. લાયબ્રેરી પાસે, એલીસહીજ, અમદાવાદ-૩૮૦૦૦૬.
પરિશિષ્ટ-IV, [અંતર્ગત નિયમ ૮(૧)] કલબ નોટીસ (સ્થાયી મિલકત માટે)
આથી નિમ્નલિખિત પંજાબ નેશનલ બેંક, ના અધિકૃત અધિકારીએ સરકારી એક્ટ-૨૦૦૨ હેઠળ સિક્યોરીટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ગેસમેન્ટ) રૂલ્સ-૨૦૦૨ ની સત્તાની રૂબેરૂ ૧૩(૧૨) સાથે વંચાતા રૂ.૩, સિક્યોરીટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ગેસમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ હેઠળ તા. ૧૪.૧૦.૨૦૨૨ ના રોજ મંગલવા નોટીસ મોકલી કરવાદાર / ગૌરોદાર શ્રી કીશોરસિંહ કરસલિંહ ગોહીલ (કરચર અને ગૌરોદાર) અને શ્રીમતી હર્ષાલા કિશોરસિંહ ગોહીલ (સહ-કરચર અને ગૌરોદાર) (A/c. No. 0281305017218) ને નોટીસમાં જણાવેલ રૂ. ૫૮,૨૧,૧૩૫.૩૪ (અંકે રૂ. અઠાવન લાખ એકવીસ હજાર એકસો પાંચાસીસ અને એકત્રીસ પેસા પુરા), બાદ વસૂલાત બે હોય તો, તા. ૧૩.૧૦.૨૦૨૨ સુધી, સાથે સંપૂર્ણ વસૂલાત અને / અથવા સૂકવણી ન થાય ત્યાં સુધીનું સૂકવવા પાત્ર વ્યાજ અને ખચાઓ, કોસ્ટ, ચાર્જિસ વગેરે, આ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસોમાં સૂકવવા માટે જણાવેલ હતું.
કરચરદાર/ગૌરોદાર/ગૌરોદાર રકમ સૂકવવામાં નિષ્ફળ ગયા હોઈ, આથી કરચરદાર/ગૌરોદાર/ગૌરોદાર અને આખરબંધાને નોટીસ આપી જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે જણાવેલ કારણોથી કલમ ૧૩(૧) સાથે જણાવેલ નિયમો વાંચતા નિયમ ૮ હેઠળ તેમને મળેલી સત્તાની રૂબેરૂ નીચે જણાવેલ મિલકતનો તા. ૧૪.૦૫.૨૦૨૩ ના રોજ વાસ્તવિક કબજે લઈ લીધેલ છે.
આથી ખાસ કરીને કરચરદાર/ગૌરોદાર અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે નીચે જણાવેલ મિલકતનો સોદો કે ચેચાએને લગતી કાર્યવાહી કરવી નહીં અને કોઈપણ પ્રકારનો વ્યવહાર કરેલ હશે તો તે પંજાબ નેશનલ બેંક નાં રૂ. ૬૫,૨૦,૩૩૨.૪૧ (અંકે રૂ. એકસાઠ લાખ વીસ હજાર એકસો બીસ અને એકત્રીસ પેસા પુરા) તા. ૩૦.૦૪.૨૦૨૩ સુધી અને સાથે સંપૂર્ણ સૂકવણી ન થાય ત્યાં સુધીનું સૂકવવા પાત્ર વ્યાજ અને તેના પરનાં ખચાઓને સાધિન રહેશે. (૧૨.૦૫.૨૦૨૩ સુધી ફરી કરેલ ૧૩(૨) ની નોટીસ બાદ વસૂલાત થયેલ રકમ: નથી).
તારાણમાં મુકેલ મિલકતને છોડવા માટે ઉપલબ્ધ સમજાના સંદર્ભમાં કારણોની કલમ ૧૩ની પેટા કલમ (૮)ની જોગવાઈ અનુસાર કરચરદારને આમંત્રિત કરવામાં આવે છે.
સ્થાયી મિલકતનું વર્ણન
સ્થાયી મિલકતનો તમામ ભાગ માંગ હોસ્ટેલ, ૧૩૦૨ (એ-૧૩૦૨) બ્લોક નં. ૦૧, ૧૩મી માળે, બાંધકામનું શ્રેણિક ૦૯.૯૩ સો.મી. બીલ્ડ-અપ ઓરીયા અને ૦૫.૦૮ સો.મી. કાર્પેટ ઓરીયા, આર્યાન ગ્લોરીયા સ્કીમ તેની સાથે તેના પરનું બાંધકામ અને ૨૫.૫૫ સો.મી., બ્લોક/સર્વે નં. ૫૧૬/એ, ૫૨૦, ૫૨૨, ટી.પી. નં. ૩, (બોપલ) એન્ક.પી. નં. ૧૮૮, એન્ક.એ ગમીન ૫૨ બાંધકામ, મોજે બોપલ, તાલુકા દસકોઈ, છુલ્લો અમદાવાદ ખાતે આવેલ મિલકત. માલિક: શ્રી કિશોરસિંહ કરસલિંહ ગોહીલ અને શ્રીમતી હર્ષાલા કિશોરસિંહ ગોહીલ. ચલુતીમાં: પુર્વ: ફેબ્રે ૦૧, એ-૧૩૦૧, પશ્ચિમ: ફેબ્રે ૦૧, એ-૧૩૦૩, ઉત્તર: ફેબ્રે ૦૧, એ-૧૩૦૩, દક્ષિણ: માર્ગુન સાથવા બગીચામાં સર્વે નં. ૫૧૩.
તા. ૧૪.૦૫.૨૦૨૩, સ્થળ: અમદાવાદ સહી- અધિકૃત અધિકારી, પંજાબ નેશનલ બેંક

એમ્કો એલીકોન (ઈન્કિયા) લિમિટેડ
CIN : L29199GJ1974PLC002574
રજીસ્ટર્ડ ઓફિસ: આર્દા-સોલુના રોડ, વલ્લભ વિદ્યાનગર-૩૮૬૨૨૦.ગુજરાત
Ph : (02692) 230602 Fax : (02692) 236506.
Email : investor@eimcoecon.in Website : www.eimcoecon.in
નોટિસ
(કંપનીના ઈન્કિયા રોડરકોના ધ્યાન માટે)
કંપનીના ઈન્કિયા રોડરકોને ઈન્વેસ્ટર ઓફરકોન ઓફ પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ) ઓબોરિટી માં તબદીલ કરવા માટે.
કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૨૨(૬) ની જોગવાઈઓ મુજબ સાથે ઈન્વેસ્ટર ઓફરકોન અને પ્રોટેક્શન ફંડ ઓબોરિટી (એક/ઈન્કિયા, સીકિટ, ટ્રાન્સફર અને સીકિટ) નિયમો, ૨૦૧૬ ('નિયમો') જે ઇ મિનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ (એમસીઓ) ભારત સરકાર દ્વારા સુધિત કરવામાં આવ્યા છે અને તેના પછીના સુધારા મુજબ નોટિસ આપવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન જાહેર કરાયેલ ડિવિડન્ડ, જેના ઉપર સાત વર્ષ સુધી દાવો ચાલેલ નથી તે આઈઈપીએફ માં જમા કરવામાં આવશે. આ અનુસૂચિ શેર કે જેના ઉપર સાત વર્ષ સુધી ડિવિડન્ડ સુકવાયેલ નથી અથવા દાવો કરવામાં આવેલ નથી તે નિયમોમાં સુધિત કાર્યવાહી મુજબ તબદીલ કરવામાં આવશે.
કંપની દ્વારા એવા રોડરકો આઈઈપીએફ માં તબદીલ કરવામાં આવશે નહીં જેના ઉપર કોર્ટ / ટ્રિબ્યુનલનો કોર્ટ ચોક્કસ આદેશ ફરમાવવા માં આવ્યો હશે જે આવા રોડરકો તબદીલ નો અટકાવવો અથવા ડિપોઝિટરીઝ ધારા, ૧૯૬૨ હેઠળ આવા રોડરકો ના ગૌરો મુકવવામાં આવ્યો હશે.
કંપનીનો સંબંધિત રોડરકોને જે એમના શેર આઈઈપીએફ ના નિયમો હેઠળ તબદીલ કરવા માટે જવાબદાર છે, તેમને જોગ્ય પડતાં તેવા માટે વ્યક્તિગત રીતે પત્ર વ્યવહાર કરવે છે. સંબંધિત રોડરકોને જે એમના શેર આઈઈપીએફ ઓબોરિટીને તબદીલ કરવા જોગ્ય છે તે તેમના રોડરકો વિગતો ચકાસવા માટે વેબ સાઈટ www.eimcoecon.in નો સંદર્ભ લઈ શકે છે.
રોડરકોને જે એમને નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ થી ડિવિડન્ડ સુકવાયેલ નથી અથવા દાવો કરેલ નથી, તેઓ નો વિગતો કરવામાં આવે છે કે તેઓ કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્સી લીક ઈન્ફર્મર્સ ઈન્કિયા પ્રા. લિ. નો ડિવિડન્ડ નો દાવો કરવા માટેની અરજી કરીને આઈઈપીએફ માં તબદીલ થાય તે પહેલાં મેળવી લેવામાં આવે.
વાસ્તાવિકતા રોડરકોને જે એમને તેમના શેર નોટિસ સ્વરૂપે ધરાવે છે અને એમના રોડરકો આઈઈપીએફ ખાતે તબદીલ કરવાને પાત્ર છે તેઓ નોટી લે કે તેમણે ધારણ કરેલ અસલ શેર સર્ટીફિકેટ સામે કંપની નવા શેર સર્ટીફિકેટ બની કરીને તેમને કિમેટ હોર્મમાં સુધિત કરશે અને તેને તુરંતજ આઈઈપીએફ ઓબોરિટી દ્વારા સાચુ કરાયેલ કિમેટ ખાતામાં તબદીલ કરવામાં આવશે. આ શેર ખરી વચાવી અસલ શેર સર્ટીફિકેટ જે રોડરકોના નામે નોંધાયેલા છે, તે સ્વચ્છ રદ થશે અને તે રદબાતલ માની લેવામાં આવશે. જે રોડરકોને તેમના રોડરકો કિમેટ હોર્મમાં ધરાવે છે તે કિસ્સામાં રોડરકો તેમના કિમેટ ખાતા માંથી તબદીલ કરવા કંપની દ્વારા આઈઈપીએફ ઓબોરિટી જે હવે પછી જે સૂચન કરે તે અનુસાર કોર્પોરેટ એક્શન દ્વારા સંબંધિત ડિપોઝિટરીઝને જણાવવામાં આવશે.
જો કંપનીનો સંબંધિત રોડરકોને પાસેથી ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ અથવા તે પહેલાં કોર્ટ સંચાર સ્વરૂપે પ્રાપ્ત નહીં થાય તો કંપની તેવા રોડરકો આઈઈપીએફ ઓબોરિટી સાથે જમા કરાવશે. આ શેરો ઉપર ડિવિડન્ડ જાહેર કરવામાં આવશે, તો તે પણ આઈઈપીએફ ખાતે જમા કરવામાં આવશે. કંપની સામે બાકી રહેલા ડિવિડન્ડનાં સંબંધમાં કોઈપણ દાવો કોઈ રોડરકો નહીં આ રોડરકો આઈઈપીએફ ખાતે તબદીલ કરવામાં આવશે. શેર અને તેનું ડિવિડન્ડ આઈઈપીએફ ખાતે તબદીલ થયા પછી કંપની સામે તે સંબંધે કોઈપણ દાવો કરી શકાશે નહીં. જો કોઈ રોડરકોને તેનો દાવો કરવો હોય તો આઈઈપીએફ નિયમોમાં જણાવ્યા મુજબ આઈઈપીએફ ઓબોરિટીને અરજી કરી શકે છે. દાવો કરવાની પ્રક્રિયા આઈઈપીએફ ની વેબસાઈટ www.liprf.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે.
રોડરકોને ઉપરોક્ત ઠાણ અને તેના નિયમો અંગે કોઈપણ ઠાણની સમસ્યા હોય તો તે કંપનીને ઉપર જણાવેલ સંખ્યા અથવા કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્સી નીચે જણાવેલ સંખ્યા સંપર્ક કરવા વિનંતી.
લીક ઈન્ફર્મર્સ ઈન્કિયા પ્રા. લિ. સુની, એમ્કો એલીકોન (ઈન્કિયા) લિમિટેડ, બી ટાવર, બી-૧૦૨, ૧૦૩, સાંજીલા કોમ્પ્લેક્સ, પહેલો માળ, એચ ડી એલ સી ઈલ ની પાસે, રાધાકૃષ્ણ ચાર રસ્તા પાસે, અહોદા, વાડોદરા-૩૬૦૦૨૦, ફોન: + ૯૧ ૨૬૫-૨૩૫૬૫૭૩, ૬૧૩૬૦૦૦. ફેક્સ: + ૯૧ ૨૬૫-૨૩૫૭૩૧
ઈમેલ: radodara@linkintime.co.in વેબસાઈટ: www.linkintime.co.in.
એમ્કો એલીકોન (ઈન્કિયા) લિમિટેડ વતી, સહી- સિદ્ધેશભુષર દલવાડી - કંપની સેક્રેટરી
સ્થળ : વલ્લભ વિદ્યાનગર તારીખ : ૧૬મી મે, ૨૦૨૩

SURYODAY
A BANK OF SMILES
SURYODAY SMALL FINANCE BANK
Audited Financial Results for the Year ended March 31, 2023

AUM ₹6114 CRORES ▲ 20.7%
Deposit ₹5167 CRORES ▲ 34.2%
Disbursements ₹5083 CRORES ▲ 44.1%
GNPA ▼ 3.1%
NNPA ▼ 1.5%
PAT ₹77.7 CRORES

Particulars	Year Ended March 31, 2023 Audited	Year Ended March 31, 2022 Audited
1. Interest earned	1,183.7	941.8
2. Other Income	97.4	93.6
3. Total Income (1+2)	1281.1	1035.4
4. Interest Expended	437.1	357.4
5. Operating Expenses	506.5	413.1
6. Total Expenditure (4+5) including provisions and contingencies	943.6	770.5
7. Operating Profit before Provisions and Contingencies (3-6)	337.5	264.9
8. Provisions (other than tax) and Contingencies	236.6	392.0
9. Profit (+)/ Loss (-) before tax (7-8)	100.9	(127.1)
10. Tax expense	23.2	(34.1)
11. Net Profit (+)/ Loss (-) for the period (9-10)	77.7	(93.0)
12. Network*	1584.7	1